

**B.Com. Semester - 5 (CBCS) Examination
July-2025 (Old Course)
INDIRECT TAX LAW - 1 (DISC. SPE. ELE -3)**

Time: 2:30 Hours**Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧	પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાનો તફાવત સમજાવો. પરોક્ષ કરવેરાના પ્રકારોની સમજૂતી આપો.	(૨૦)
	અથવા	
પ્રશ્ન.૧	પરોક્ષ કરવેરાના મૂળભૂત સિધ્ધાંતો સમજાવી પરોક્ષ કરવેરાના સત્તામંડળનું કાર્યક્ષેત્ર ચર્ચો.	(૨૦)
પ્રશ્ન.૨	સર્વિસ ટેક્સ હેઠળ સેવાનું અર્થઘટન સમજાવો તેમજ તેના સામાન્ય સિધ્ધાંતો ચર્ચો.	(૨૦)
	અથવા	
પ્રશ્ન.૨	સર્વિસ ટેક્સની ગણતરી યોગ્ય ઉદાહરણ દ્વારા વિસ્તૃત રીતે સમજાવો.	(૨૦)
પ્રશ્ન.૩	નીચેના સર્વિસ ટેક્સ અંગેના ખ્યાલો સમજાવો;	(૧૫)
	1) પેનલ્ટી	
	2) CENVAT ક્રેડિટ	
	3) રિટર્ન ફાઈલિંગ	
	અથવા	
પ્રશ્ન.૩	કરપાત્ર સેવાઓ અને તેના મૂલ્યાંકન અંગે વિસ્તૃત સમજૂતી આપો.	(૧૫)
પ્રશ્ન.૪	VAT એટલે શું? VAT ની ગણતરી યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો.	(૧૫)
	અથવા	
પ્રશ્ન.૪	ઈનપુટ ટેક્સ ક્રેડિટ અને કમ્પોઝિશન સ્કીમ અંગે વિગતવાર સમજૂતી આપો.	(૧૫)

ENGLISH VERSION

Que.1	Explain the difference between direct and indirect taxes.Explain the types of indirect taxes.	(20)
	OR	
Que.1	Describe the jurisdiction of the indirect taxation authority by explaining the basic principles of indirect taxation in detail.	(20)
Que.2	Explain the interpretation of services under service tax as well as its general principles.	(20)
	OR	
Que.2	Explain the calculation of service tax in detail by the appropriate examples.	(20)
Que.3	Explain following concepts regarding service tax:	(15)
	1) Penalty	
	2) CENVAT Credit	
	3) Return Filing	
	OR	
Que.3	Give a detailed explanation on taxable services and its valuation.	(15)
Que.4	What is VAT? Explain the calculation of VAT with the appropriate illustration.	(15)
	OR	
Que.4	Give a detailed explanation about input tax credit and composition scheme.	(15)
